https://archive.org/details/bk889/page/n0/mode/1up

2015-02-15 -Narayan Raiya Limbani Parichay (889)

All Items on https://archive.org/details/realpatidar

realpatidar.com

Full Library on https://realpatidar.com/library

સમાજનું સાચું પ્રતિબિંબ

Posting Licence No. PATAN / 111 / 2014-2016
LPWP No. : CPMG/GJ/108/2012
Office of Posting - PATAN H.O.
Valid up to 31-12-2016
Posting Date : 17th every month
RNI No. GujGuj/2010/32748

પાટીદાર બંધુ

* વર્ષ - ૫ * અંક : ૯ * પેજ-૩૨ *
છૂટક કિંમત : ૧૭ રૂપિયા
તારીખ : ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૫

માસિક સમાચાર પત્ર

વસંત પંચમીના દિવસે દેશભરમાં ૧૮ જગ્યાને સમૂહલગ્નોત્સવમાં ૨૦૭ યુગલોએ ભાગ લીધો

આવો ઓળખીએ.....
લખપત તાલુકાના સનાતની ક્રાંતિવીર
પૂ. નારાયણ રૈયા લીંબાણીને....

realpatidar.com

https://archive.org/details/bk889/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com - Created using: {script_name}

https://archive.org/details/bk889/page/n2/mode/1up

2015-02-15 -Narayan Raiya Limbani Parichay (889)

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.19 17:54:18 +05'30'

realpatidar.com

સમાજનું સાચું પ્રતિબિંબ

Posting Licence No. PATAN / 111 / 2014-2016
LPWP No. : CPMG/GJ/108/2012
Office of Posting - PATAN H.O.
Valid up to 31-12-2016
Posting Date : 17th every month
RNI No. GujGuj/2010/32748

પાટીદાર બંધુ

* વર્ષ - ૫ * અંક : ૯ * પેજ-૩૨ *
છૂટક કિંમત : ૧૭ રૂપિયા
તારીખ : ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૫

માસિક સમાચાર પત્ર

વસંત પંચમીના દિવસે દેશભરમાં ૧૮ જગ્યાને સમૂહલગ્નોત્સવમાં ૨૦૭ યુગલોએ ભાગ લીધો

આવો ઓળખીએ.....
લખપત તાલુકાના સનાતની ક્રાંતિવીર
પૂ. નારાયણ રૈયા લીંબાણીને....

realpatidar.com

https://archive.org/details/bk889/page/n3/mode/1up

realpatidar.com

સનાતની ક્રાંતિના પાયાના લડવૈયા

નારાયણ રૈયા લીંબાણી દયાપર વાળાનો પરિચય

અહેવાલ : નરસિંહભાઇ લીંબાણી-નડીયાદ દ્વારા

મુસ્લિમ સૈયદોના સતપંથની ચંગુલમાં ફસાયેલી આપણી જ્ઞાતિને નારાયણ રામજી લીંબાણીએ બહાર કાઢી હતી. તે સૌ કોઇ જાણે છે. લોકોને જાગૃત કરી સત્ય તરફ વાળવા બહુ મુશ્કેલ કામ હોય છે. નારાયણ રામજી લીંબાણીએ આવુ ભગીરથ કામ કર્યું હતું. પરંતુ આ ભગીરથ કાર્ય પાર પાડવા માટે તેમણે ઘણા સાથીદારો મળ્યા હતા. નારાયણ રામજીની સનાતની ક્રાંતીને ખૂબ જ સફળતા મળી હતી. ખાસ કરીને લખપત તાલુકામાં તેઓ ખૂબ જ ઝડપી સફળ થયા હતા. કારણ કે લખપત તાલુકામાં તેમને નારાયણ રૈયા લીંબાણી જેવા નરબંકાનો સંપૂર્ણ સાથ-સહકાર મળ્યો હતો. નારાયણ રૈયા લીંબાણીએ નારાયણ રામજી સાથે ખભેથી ખભા મળાવી લોકોને જાગૃત કરવાનો ભગીરથ પ્રયાસ કર્યો હતો. જેના ફળશ્રુતીરૂપે આજે લખપત તાલુકો સતપંથ-સનાતન વિવાદોથી યોજનો દૂર શાંતિ અને સામાજિક ભાઈચારા રૂપી મીઠા ફળો ખાઇ રહ્યો છે. તો આવો ઓળખીએ નારાયણ રૈયા લીંબાણીને.



દયાપર ગામની સ્થાપના સંવત ૧૯૩૫ વૈશાખ સુખ ૩ના દિવસે કરવામાં આવી. ડાહ્યાદેવજી પારસીયાના નામ ઉપરથી દયાપરનું નામ આપવામાં આવ્યું. દયાપર ગામનું તોરણ બાંધ્યું ત્યારે ડાહ્યા દેવજી પારસીયા, રૈયા કરસન લીંબાણી, ભીમજી સામા લીંબાણી, જીવા પાંચા લીંબાણીની હાજરી હતી. પારસીયા તેમજ લીંબાણી પરિવારે રસાલીયાથી આવી દયાપર ગામની સ્થાપના કરી. દયાપરમાં વસાવટ કર્યો અને આજુબાજુથી પોતપોતાના સગા બોલાવી સુખ ચેનથી રહેવા લાગ્યા અને ખેતીવાડી અને ઢોર ઉછેરનો વ્યવસાય વારસામાં મળેલ તે ચાલુ કર્યો.

બીજુ દયાપરના પટેલ રૈયા કરસન લીંબાણી પરિવારમાં છ દિકરા અને બે દિકરીનો પરિવાર હતો. તેમાં સૌથી નાના દિકરા નારાયણ રૈયાનો જન્મ ઇ.સ. ૧૮૯૦માં દયાપર ખાતે થયો.

નારણ રૈયા બાળપણથી હોશિયાર અને ઉદ્યમી હતા. તેમણે સ્કૂલમાં અભ્યાસ કરવાની તક નહોતી મળી પણ તેમના પિતા રૈયા કરસનની પાસે અક્ષર જ્ઞાન હતું. તેથી તેમની પાસેથી નારાણ રૈયા વાડીમાં કોશ ચલાવતા ચલાવતા અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરેલ.

ત્યારબાદ નાની ઉંમરથી કરાચીમાં કામ કરવા જતા. ત્યાં ઇ.સ. ૧૯૨૦ સુધી રહ્યા અને રોડ કન્સ્ટ્રકશનનું કામ કરતા. તેમના લગ્ન લખપત તા.ના ધારેશી ગામના પટેલ જેઠા રતનશી સાંખલાની દિકરી જાનબાઇ સાથે થયેલ અને ચાર દિકરા અને બે દિકરીનો પરિવાર હતો. નારાણ રૈયા ૧૯૨૦માં પહેલી પરિષદ કરાંચીમાં ભરાણી ત્યારથી નારાણ રામજી લીંબાણીના પરિચયમાં હતા અને પરિષદમાં ભાગ લીધો ત્યારથી પીરાણા અને સનાતનનો ભેદ ભરમ જાણવા લાગ્યા હતા.

ઇ.સ. ૧૯૨૦ પછી કરાંચીને બદલે મુંબઇને કર્મભૂમિ બનાવી. અને ઘાટકોપર વસવાટ કરતા અને મકાન બાંધકામના કોન્ટ્રાકટ રાખતા. ત્યારબાદ દાદર ખાતે પોતાની માલિકીની જગ્યામાં શ્રી સ્પ્રીંગ કોન્ફીટના નામે ઇ.સ. ૧૯૩૦માં ટાઇલ્સ તેમજ ઝાળી બનાવવાનું કામ ચાલુ કરેલ અને ટૂંક સમયમાં સારી સફળતા મળેલ પાછળથી તેમના દિકરા વિશ્રામ નારાણ, દામજી

realpatidar.com

https://archive.org/details/bk889/page/n4/mode/1up

નારાણ તથા નાનજી નારાયણના બહુ સારા સહકારથી ધંધામાં સારી સફળતા મળેલ અને તે એરીયા પણ નારાણ પૂરી તરીકે મુંબઇમાં ઓળખાતો અને કચ્છમાંથી આવતા જતા આપણી સમાજના ભાઇઓ માટે એક આશ્રય સ્થાન બન્યું.

બીજું ધંધામાં સારી સફળતા મળવાથી અને ઉદાર દીલને લીધે માદરે વતન દયાપરમાં ૧૯૬૦-૧૯૭૦ના સમય દરમ્યાન દવાખાનું, વોટર સપ્લાય, સ્કૂલ, સ્ટેશન, ગામ લોકોના સહકારથી તેમજ નારાણ રૈયા તેમજ તેમના વારસદારો તરફથી ખૂબ સારો સહકાર મળેલ તેમાં દવાખાનું અને સ્ટેશન દયાપર ખાતે સ્વ ખર્ચે બનાવી ગામને અપર્ણ કરેલ અને દયાપર હાઇસ્કૂલમાં પણ વિશેષ ફાળો આપી માતૃશ્રી જાનબાઇ નારાણ રૈયા હાઇસ્કૂલના નામકરણ કરાવેલ. બીજી નારાણ રૈયાના ભત્રીજા પ્રેમજી મુળજી રૈયા લીંબાણી પણ દયાપરના એક સપુત હતા. તેમને પણ દયાપર ગામના વિકાસ માટે જાતે હાજર રહી દવાખાના, સ્કૂલ, વોટર સપ્લાયમાં જાત દેખરેખ રાખી હાજર રહી ગામની સેવા કરી પાછળથી તેમના દિકરા ભવાનજી પ્રેમજી/જેન્તીલાલ પ્રેમજીએ પણ તેમના પિતાજીનું નામ રોશન કરવા અને દયાપરની સેવા કરવા બહુ મોટી રકમ આપી દયાપર સ્કૂલનું નામ શ્રી પ્રેમજી મુળજી લીંબાણી વિદ્યાલય રાખ્યું અને ગામની સેવા કરવાનો યશ ભાગી બન્યા.

ત્યારબાદ ઇ.સ. ૨૦૧૨ના નારાણ રૈયાના પૌત્રાએ હરીલાલ વિસરામ, રમેશ દામજી, પ્રવિણ દામજીએ તેમના દાદા નારાણ બાપાનું નામ રોશન કરવા દયાપર ખાતે સત્ય નારાયણ સમાજને બહુ મોટી રકમ (૩૪) દાનમાં આપી. નારાણ રૈયા લીંબાણી ભોજનાલય નામકરણ કરાવી સમાજની સેવા કરવાના યશ ભાગી બન્યા.

બીજુ નારાણ રૈયા લીંબાણી ૧૯૨૦ પછી મુંબઇ રહેવા લાગ્યા અને ઘાટકોપર ખાતે નારાણ રામજી નાયા શિવજી (નાય નગર) (અ. ભા. ક. ક.પા.સ.) સમાજના પહેલા પ્રમુખ શીવદાસ કાનજી સાથે સારી મિત્રતા હતી. અને સાથે કામ પણ કરતા અને નારાણ રૈયા સાથ તેમના મિત્ર તેમજ વેવાઇ કાનજી કેશરા પારસીયા પણ કામ કરતા અને નારાણ રામજી લીંબાણીના પીરાણી વિરુધ્ધ કાર્યમાં ૧૯૨૧થી સહકાર આપવા લાગ્યા અને નારાણ રૈયા તેમજ કાનજી કેશરા નારાણ લીંબાણીને કહ્યુ અમો તમારા સનાતની કામમાં પૂરો સહકાર આપશું અને દયાપરના બીજા ઘણા ભાઇબહેનોને તૈયાર કરશું.

સનાતનની ક્રાંતિ લાવનાર નારાણ રામજી લીંબાણીની ઉંમર ત્યારે ૨૫ વર્ષની હતી. ત્યારથી સમાજ સેવાની ભેખ લઇ લીધી. સમાજમાં જાગૃતિ લાવવા મુંબઇમાં કડવા પાટીદાર યુવક મંડળ અને જ્ઞાતિ હીત ચિંતવર્ધક મંડળની સ્થાપના કરી જે ભાઇઓ સનાતન ધર્મ સ્વીકાર્યો તે જ્ઞાતિ હીત ચિંતવર્ધક મંડળવાળા અને કડવા પાટીદાર યુવક મંડળના દરેક ભાઇઓ હાજરી આપતા અને નારાણ રામજી દરેકને સમજાવતા પણ કચ્છના ગઢેરાની બીકે કોઇની હિંમત ચાલતી નહીં. આમ કરતો ઘણો સમાજ નીકળી ગયો પણ ૭ના આઠના થયા ત્યારબાદ એવો વિચાર આવ્યો કે આપણી સમાજની મોટી વસ્તી કરાંચીમાં છે તો કરાંચી ખાતે આપણે પરિષદ ભરીએ. આમ વિચાર તા. કરાંચી ખાતે પહેલી પરિષદ ઇ.સ. ૧૯૨૦માં તા. ૮/૮/-૧૧/૮/૧૯૨૦ શ્રાવણ માસમાં ચાર દિવસ માટે પરિષદનો સમય નક્કી કર્યા પછી પરિષદના પ્રમુખ કોને બનાવવા તેના માટે ઘણું વિચાર્યા પછી એવું નક્કી કરવામાં આવ્યું કે કરાંચીના પ્રખ્યાત કોન્ટ્રાક્ટર કચ્છ માનકુવા વાળા રાજા સામજી ધોળુને નક્કી કરવામાં આવ્યા અને સમજ મુજબ પરિષદ ચાલુ થઇ તેમાં ૧૮૦૦ માણસની હાજરી હતી. તેમાં ૪૦૦ બહેનોએ ભાગ લીધો તેમાં ઘણા ભાષણ થયા ચર્ચા થઇ પણ પીરાણા વિરુધ્ધ ઠરાવ પસાર ન થઇ શકયો અને પરિષદ પૂરી થઇ કચ્છમાં બેઠેલા ગેઢેરાના જો હુકમીથી કોઇ આગળ ન આવી શકયું. આ પરિષદથી નારાણ રામજીને સંતોષ ન થયો પરિષદ પૂરી થતા બધા પાછા ગયા નારાણ રામજી મુંબઇ ગયા અને બધા ભેગા મળી વિચાર્યું બીજુ પરિષદ ૧૯૨૧માં કચ્છમાં ભરીએ. તેવું નક્કી કર્યું.

બીજું કચ્છમાં ૧૯૨૦ની પરિષદમાં ભાગ લીધો તેમને તેમજ તેમન ાસગાની બોલાવી ગઢેરા-મુખી ત્રાસ

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk889/page/n5/mode/1up

realpatidar.com

આપવા લાગ્યા નાત બહાર મૂકવા દંડ કરવાનો ફરમાવન કરવા લાગ્યા. આ અસર રૂપે ૧૯૨૧ના નારાણ રામજીની નાદુરસ્ત તબીયતને લઇ તેમજ કરાંચીથી પણ કોઇપણ આગેવાન કારણ બતાવી હાજર ન રહ્યા. તેથી ૧૯૨૧ની પરિષદ ન ભરી શક્યા. પણ ૧૯૦૮થી ૧ પણ સભ્યના ઉમેરાયો છતાં પણ નારાણ રામજી હિંમત હારે તેમ ન હતા. તેમને ૧૯૨૨માં બીજી પરિષદ ફરી કરાંચી ખાતે ભરવાનું નક્કી કર્યું. ૭/૮-૯/૮-૧૯૨૨ના ત્રણ દિવસ માટે શ્રાવણ માસ મા.

તે ૧૯૨૨ની પરિષદના પ્રમુખ તરીકે નખત્રાણા વાળા માવજી પુંજા જબવાણી નક્કી કરવામાં આવેલ અને સમય પ્રમાણે કરાંચી ખાતે સભા ભરાવી તેમાં પણ સારી એવી સંખ્યા હાજર થઇ.

બીજી પરિષદ ઇ.સ. ૧૯૨૨માં હાજરી આપવા મુંબઇથી નારાણ રૈયા લીંબાણી તેમજ તેમના સાથી મિત્ર વેવાઇ કાનજી કેસરા પારસીયા મુંબઇથી દરિયાઇ માર્ગ મુંબઇથી કરાંચી પહોંચ્યા અને અગાઉ નક્કી કર્યા મુજબ કરાંચીમાં હાજરી આપવા તેમના મળતીયાને ટપાલ લખી જણાવેલ તમો દયાપરથી પરિષદમાં ભાગ લેવા આવશો અમો મુંબઇથી આવશું. આમ પહેલાથી નક્કી કરેલા સમય મુજબ સને ૧૯૨૧માં નારાણ રામજી સાથે વાત થયા મુજબ દયાપરના ઘણા ભાઇઓ કરાંચી ખાતે પરિષદમાં હાજર થયા સારી સેવા પણ આપીઅ ને આ પરિષદની સારી અસર થઇ અને અમુક ઠરાવ પણ પીરાણા વિરુદ્ધ પસાર કરી શકયા પરિષદ પુરી થવા પવી નારાણ રૈયા - નારણ બાપાને મળ્યા અને કહ્યું અમોને તો સમજણ પડી ગઇ છે પણ દયાપરથી આવેલ ભાઇઓને તમો પણ સમજાવો આમ કરાંચી ખાતે પરિષદ પૂરી થતા અને બધા છૂટા પડયા તે દરમ્યાન નારણ રૈયાને નારણ રામજીને કહ્યું તમોને ૧૯૨૧માં જેમ કહ્યું હતું તેમ અમારા દયાપર ગામમાંથી ૩૦૦, ૪૦૦ જણા સનાતનમાં આવવા તૈયાર છે. તો તમારી હાજરીમાં આ કામ કરવું છે. તો તમો ટાઇમ આપો આવું સાંભળતા નારણ રામજીની ખુશીનો પાર ન રહ્યો કારણ કે ૧૯૦૮થી અથાગ પ્રયત્નો કરવા છતાં મુંબઇ તેમજ કચ્છમાં કોઇ માણસ પરિવાર હિંમત ન કરી શકયો અને એક સાથે આવડુ મોટું જુથ અને તે પણ કચ્છમાં ગઢેરા અને મુખીની હાજરીમાં હિંમત કરવી કાઇ નાની વાત ન હતી. આ વાત નારણ રામજી મુંબઇ જઇ મળતીયાને વાત કરી અને બધા ખુશ થઇ ગયા અને નક્કી કર્યું ઉનાળે આમ કચ્છમાં લગ્નમાં જવું છે. તો તે વખતે દયાપર જવું નારાણ બાપા લખવા મુબજ લગ્નનું તો બહાનું હતું.

આ બાજુ નારણ રૈયા પર કરાંચીથી દયાપર ગયા ત્યાં બધા મળતીયા મિત્રો પરિવારને મળી ભેગા કરી સમજાવ્યા ત્યારબાદ મુંબઇ આવી નારાણ બાપાને મળ્યા અને સમય આવે ઉનાળે બધા કચ્છમાં ગયા અને નારાણ રામજી અને તેમના મિત્રો દયાપર આવ્યા અને બધાને ભેગા કર્યા ત્યારે નારણ રામજીએ કહ્યું બરાબર વિચારી લેજો આ કામ સહલું નથી. કારણકે ભાઇ બહેન પરિવાર સગાસંબંધ સાથે સંબંધ પુરા કરવા પડશે ત્યારે દયાપરની બહેનોએ બહુ જ હિંમત બતાવી અને નારણ બાપાને કહ્યું ભાઇ તમે હવે ઢીલી ઢીલી વાત ન કરો અમો બહુ સમજી ગયા છીએ. અમો એક પણ પળનો વિલંબ કરવા માંગતા નથી. પણ તમોએ નાસીક ખાતે જેઠ સુદ ૫ ના દિવસે સનાતન ધર્મના સ્વીકાર કરેલ તો અમો પણ તેજ દિવસે સનાતન ધર્મ સ્વીકાર્યું. આજે જેઠ સુદ ૧ છે. તો તમારાથી ચાર દિવસ દયાપર ખાતે રોકાઇ શકાય તો રોકાવો નહીં તો મટી વિરાણી આંટો મારી આવો બાકી અમો બધુ વિચારો બેઠા છીએ. ગણા દિવસ અમી. નુર ની ગોળી ખાધી સૈયદના એઠા ખાધા હવે અમોને કોઇ પણ વિચારવું નથી. આમ જેઠ સુદ ૫ના દિવસે દયાપર ખાતે ભુજ રાજયની સાહતાથી મડના રા.રા. જટાશંકર અને લખપતના સત્તાવાળ આપણી સાહતા માટે હાજર હતા અને સામે પક્ષે ખાતા વાળાના ૭-૮ ગામના ગઢેરા દયાપર ખાતે ભેગા થયા અને લાપસીના આંધણ મુકાણા અને ગણી તડજોડ ચાલી અંતે ૧૬૧ જણ એ દયાપર ખાતે સનાતન ધર્મનો સ્વીકાર કર્યો તે ગઢશીશા વાળા પરાશર શર્માના વરદ હસ્તે શુદ્ધિકરણ કરાવેલ આ સનાતન ધર્મનો સ્વીકાર કચ્છ રાજ્યમાં કચ્છ કડવા

realpatidar.com

https://archive.org/details/bk889/page/n6/mode/1up

realpatidar.com

પાટીદાર સમાજમાં સૌથી પહેલો પ્રસંગ હતો. અને તે દિવસથી શ્રી સત્ય નારાયણ સમાજની સ્થાપના થઇ.

તેમના કર્ણધાર હતા નારાયણ રૈયા લીંબાણી તે દિવસ હતો સંવત ૧૯૭૯ પ્ર. જેઠ સુદ ૫ ના શુભ દિવસે જેમની ગણા સમયની રાહ જોતા હતા તે સનાતની સૂર્ય કચ્છ રાજ્યમાં કડવા પાટીદારમાં શ્રી નારણ રૈયા લીંબાણીના નૈતૃત્વ નીચે દયાપરથી ઉગ્યો અને ત્યારથી પ્રથમ સનાતની સમાજની શ્રી સત્ય નારાયણ સમાજની દયાપર ખાતે સ્થાપના થઇ. આ વાતની જાણ કચ્છ તેમજ કચ્છ બહાર આપણી સમાજમાં થઇ ત્યારે હાહાકાર થઇ ગયો. કારણ કે ભલભલા માણસની કચ્છમાં પહેલ કરવાની હિંમત ન હોતી ચાલતી કારણ કે ૧૯૦૮થી ૧૫ વર્ષ સુધી નારાણ રામજી લીંબાણી તેમજ તેમના મિત્રોએ ખૂબ પ્રયત્ન તેમજ સંઘર્ષ કર્યા પણ ધારી સફળતા મળી ન હતી. આ વાત મુંબઇ પહોંચી ત્યારે ત્યાંના ભાઇઓ ખૂબ ખૂશ થયા અને શરમથી માથા જુકી પણ ગયા કારણ કે કરાંચી અને મુંબઇ કચ્છથી ગણા દૂર હોવા છતાં કોઇની કચ્છના ગેઢેરાના જુલ્મ સામે હિંમત ન ચાલી આની અસર રૂપે ૧ મહિના પછી અષાઢ મહીનામાં શુદ્ધિકરણનો પ્રોગ્રામ મુંબઇ ખાતે રાખવામાં આવેલ તેમાં મુંબઇના સ્થાનિક ભાઇઓ અને દયાપરથી મુંબઇ આવી શુદ્ધિકરણમાં જોડાયેલ.

અને કચ્છમાં પણ દયાપરના શુદ્ધિકરણની સીધી અસર થઇ તેના ભાગરૂપે આસો સુદ-૧૦ વિજયા દશમીના દિવસે દયાપરના બાજુમાં પાનેલી ખાતે ૧૬ પરિવાર શુદ્ધિ કરણમાં જોડાયેલ તે દયાપરના શાસ્ત્રી મણીશંકર અંબાલાલ ત્રિપાઠી ના વરદ હસ્તે શુદ્ધિ કરાવેલ ત્યારબાદ શુદ્ધિકરણનો કાર્યક્રમ દિવાળી પછી ભાઇબીજ દિવસે રવાપર ખાતે થયો.

ત્યારબાદ કરાંચી ખાતે થયો આમ ૧૫-૧૫ વર્ષથી જે માણસો ગભરાઇને પોતાની ઇચ્છા વ્યકત ન કરી શકાયા તે દયાપરના સનાતની ધર્મના શુદ્ધિકરણના કાર્યક્રમ પછી પરિવાર એક-બે જણ પણ હિંમતમાં આવી ગયા અને શુદ્ધિકરણમાં જોડાતા ગયા. આ ૧-૧॥ વર્ષમાં ૪૬૧ જણા થઇ ગયા તેવું નારાણ રામજી લીંબાણી પીરાણાની પોલમાં લખ્યું છે. ૧૯૦૮થી દબાયેલા આપણી સમાજના ભાઇબહેનો સ્પ્રીંગની માફક ઉછળ્યા અને દરેક પોતપોતાની શકિત પ્રમાણે પ્રચાર અને સમજાવવા લાગ્યા.

દયાપરના આજુબાજુના ગામમાં નારાણ રૈયા તમેજ તેમના મિત્રો મળતીયા પ્રચાર કરતા અને હિંમત પણ આપતા. આપ દયાપરના સનાતન ધર્મના અંગીકારનું મહત્ત્વ એટલા માટે વધારે છે કારણ કે ૧૯૦૮થી ૧૯૨૩ સુધી નારાણ રામજીની ટીમ ખૂબ જ પ્રયન્ત કર્યા પણ ધારી સફળતા ન મળી. પણ સં. ૧૯૭૯ જેઠ સુદ ૫ ના દયાપરના પ્રસંગ પછી દયાપરના આજુબાજુના દરેક ગામમાં સારી અસર થઇ અને ટૂંક સમયમાં આખેઆખા ગામ સનાતની બની ગયા અને કચ્છમાં લખપત તાલુકાના પાટીદારના દરેક ગામ નારાણ રૈયા લીંબાણીના પ્રયાસથી સનાતની બની ગયા.

કરાંચી ખાતે પહેલી પરિષદ ૧૯૨૦, બીજી પરિષદ ૧૯૨૨માં ભાગ લેનાર સમાજના પ્રથમ હરોળના આગેવાનોમાં પણ ' દયાપરના શુદ્ધિકરણના પ્રોગ્રામ પછી જ હિંમત આવી અને શુદ્ધિકરણ માટે આગળ આવ્યા.

બીજુ કચ્છમાં ગઢેરાનો કેવો જુલ્મ અને કેર હશે તેના દાખલા રૂપે મોટી વિરાણી માટે શ્રી લક્ષ્મીનારાયણની મૂર્તિ મુંબઇમાં તૈયાર કરાવેલ પણ સંજોગો વસાત આપણી પાટીદારના પ્રથમ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર માટે તૈયાર કરાવેલ મૂર્તિ મોટી વિરાણી ન બેસાડી શક્યા આખર આ મૂર્તિ બોરડી ટીંબા કંપામાં આપણ સમાજમાં પ્રથમ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં સંવત ૧૯૮૪ના બીજા શ્રવાણ સુદ ૧૧ ને શનિવાર તા. ૨૬/૮/૧૯૨૮ના શુભ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કરાવી આ રીતે અચાનક બોરડી ટીંબા કંપામાં આપણી સમાજનું પ્રથમ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનું મંદિર બન્યું. (મોટી વિરાણીનું ખુદ નારાણ રામજી લીંબાણીનું ગામ છે.)

આવા વિપરીત સંજોગો હોવા છતાં સંવત ૧૯૭૯ જેઠ સુદ ૫ દયાપર ગામની શરૂઆત થઇ તે બહુ જ મોટી બાબત કહેવાય તેમાં ભાગ લેનાર ભાઇ-બહેન તેમજ તેમના કર્ણધારને જેટલા ધન્યાવાદ આપી

realpatidar.com

https://archive.org/details/bk889/page/n7/mode/1up

realpatidar.com

તેટલા ઓછા છે.

બીજુ નારાણ રૈયા એ દોલતપર ખાતે શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનું મંદિર પોતે જાતે હાજર રહી કામ કરાવેલ.

નારાણ રૈયા દયાપર ખાતે પોલીસ પટેલ તરીકે, પણ સેવા આપેલ હતી. અને કોઇ વાદવિવાદમાં પંચ તરીકે સારી સેવા આપતા. નારાણ રૈયા તેમજ તેમના વારસદારોનું દયાપર ખાતે કોઇ મકાન કે ખેતર નથી છતાં કચ્છ કડવા પાટીદાર-લખપત તાલુકો તેમજ દયાપર ખાતે યથાયોગ્ય સમયે યથાયોગ્ય દાન આપવા માટે ક્યારે પાછી પાની કરી નથી આ પણ એક સમાજ માટે દાવા દાંડી સમાન છે.

નારાયણ રૈયા લીંબાણીએ ૧૯૫૯માં બોર્ડીંગ માટે નખત્રાણા ખાતે ૫૦૦૦/-નું દાન આપેલ તે નખત્રાણા ખાતે આરસની તકતીમાં કંડારેલ છે.

બીજુ અમો ૨૦૦૯ના એક કામ માટે વહીચંપાં પાસે અમદાવાદ ગયા ત્યારે અમોને પુછવામાં આવ્યું તમો ક્યા ગામથી આવો છો. અમોએ કહ્યું દયાપરથી તો વહીવંચાએ સીધું જ કહ્યું નારાણ રૈયા વાળુ દયાપર અમોએ કહ્યું તમો એમને કે ઓળખો છો તેમને કહ્યું અમારા બાપ દાદા એમ કહેતા હતા કે પિરાણા વાળાએ જ વહીવટો બંધ કરાવેલ તે ચાલુ કરાવવા નારાણ રામજી લીંબાણી અને નારાણ રૈયા લીંબાણી અમારા વડીલોને શોધતા શોધતા ધોળકા આવેલ અને અમારો હક પાછો અપાવેલ અને ચોપડા ચાલુ કરાવેલ તેથી અમારા વડીલોએ કહ્યું આ વડીલને ભૂલવા નહીં. ઉપર મુજબના ધાર્મિક, સામાજિક, પારિવારિક, કામ કરતા કરતા આખરે તા. ૨૮-૫-૧૯૭૦ વૈશાખ વદ ૮ના કોલ્હાપુર ખાતે અવસાન થયું.

નારાણ રૈયા લીંબાણીનું આ ૧૨૫મુ જન્મ જયંતી વર્ષ છે. (૧૮૯૦ થી ૨૦૧૫) આ હતો નારાણ રૈયા લીંબાણી દયાપર વાળાનો પરિચય. નારાયણ રૈયાનો પરિવાર અત્યારે કોલ્હાપુર અને હુબલીમાં રહે છે.

(૧) હરીલાલ વિશ્રામ નારાયણ લીંબાણી-કોલ્હાપુર, (૨) રમેશ દામજી નારાણ લીંબાણી-હુબલી, (૩) પ્રવિણ દામજી નારાયણ લીંબાણી-હુબલી.

૧૪ ફેબ્રુઆરી એટલે... 'માતૃ-પિતૃ પૂજન દિવસ'

પશ્ચિમી વિકૃતિ સાથે સનાતની સંસ્કૃતિને ઉજાગર કરતા દેશભરમાં કરોડો સંસ્કૃતિ પ્રેમી લોકો એ ૧૪ ફેબ્રુઆરીના રોજ કહેવાતા પ્રેમ દિવસને માતા-પિતાના ચરણોમાં સમર્પિત કરી સાચા અર્થમાં પ્રેમ દિવસને સાર્થક કર્યો હતો. વેલેન્ટાઇન ડે તરીકે ઉજવાતા આ દિવસને કરોડો લોકો હવે માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ધામધૂમથી ઉજવી રહ્યા છે. પ્રસ્તુત દૃશ્ય અમદાવાદમાં આવેલ કાંકરીયા ફૂટબોલ ગ્રાઉન્ડની છે. જેમાં હજારો સંતાનો એ પોતાના માતાપિતાનું પૂજન કરી પ્રેમ દિવસની ઉજવણી કરી હતી.

realpatidar.com